

12th February, 2022

To. The Corporate Relations Department **BSE Limited** P. J. Towers, Dalal Street, Mumbai-400001, Maharashtra

Sub.: Newspaper Publication of Unaudited Financial Results for Quarter and Nine Months ended 31st December, 2021.

Scrip Code: 540492

Dear Sir/Madam,

Pursuant to the provisions of Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we are pleased to enclose herewith a Newspaper copy of Extract of Unaudited Financial Results for the Quarter and Nine Months ended 31st December, 2021 published in "Financial Express" (English) and "Gujarat Guardian" (Gujarati) newspaper dated 12th February, 2022.

Kindly take the same on your record and oblige.

Thanking you,

Yours faithfully,

For STARLINEPS ENTERPRISES LIMITED

KHUSHBOO MODI

Company Secretary & Compliance Officer

ACS No.: 57323

Encl: As above



STARLINEPS ENTERPRISES LIMITED

formerly known as Starline Precious Stone Limited) (CIN: L36910GJ2011PLC065141) Reg. Off.: Shop - F/1, 1st Floor, Athwa Ark Shopping Centre, Opp. Yatim Khana, Athwa Gate, Surat-395001, Gujarat. Tel.: 0261-2600343

Email: info@starlineps.com, Website: www.starlineps.com Extract of Standalone Unaudited Financial Results for the Quarter and

	Nine Months Ende	Quarter ended	(₹ in lakhs except EPS Quarter ended	
Sr. No.	Particulars	31.12.2021 (Unaudited)	31.12.2021 (Unaudited)	31.12.2020 (Unaudited)
1	Total income from operations (net)	373.00	1074.88	408.46
2	Net Profit /(Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	14.36	32.35	105.71
3	Net Profit /(Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	14.36	32.35	105.71
4	Net Profit /(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	12.16	25.35	105.71
5	Total comprehensive Income for the period [comprising Profit/(Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	0.00	0.00	0.00
6	Equity Share Capital	2161.50	2161.50	2161.50
7	Face value of Equity Share Capital	5.00	5.00	10.00
8	Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of previous year)	0.00	0.00	0.00
9	Earnings per share (of Rs. 5/- each) (for continuing and discontinued operations)			
	Basic:	0.03	0.07	0.49
	Diluted:	0.03	0.07	0.49

- . The above is an extract of the detailed format of Unaudited Financial Results for the Quarter and Nine Months ended on 31.12.2021 filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly and Nine Month Unaudited Financial Results is available on the Stock Exchange website: www.bseindia.com and on the Company's Website: www.starlineps.com
- 2. The above financial Results have been reviewed by the Audit Committee an approved by the Board of Directors at their respective meetings held on 11th February, 2022.
- . The results have been prepared in accordance with the Indian Accounting Standards (Ind AS) as prescribed under Section 133 of the Companies Act, 2013 read with levant rules issued thereunder

FOR STARLINEPS ENTERPRISES LIMITED (Formerly known as Starline Precious Stone Limited,

SHWETKUMAR KORADIYA

Chairman & Managing Director

DIN: 03489858

Place : Surat. Date: 11-02-2022



Navsari Branch,

Tower Road, Navsar he Security Interest Enforcement Rules 2002 Rule 8 (1) POSSESSION NOTICE (For Immovable Property)

Whereas The Undersigned being the Authorized Officer of the Central Bank of ndia Navsari Branch Navsari, under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of powers conferred under section 13(12), 13(2) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 01.08.2019 under section 13 (2) of the said act calling upon the Borrowers Mr. Krishna Sahebrao Gadge (Borrower), Mrs. Ashaben Krishna Gadge (Co-Borrower), Mrs. Champaben Sahebrao Gadge (Co-Borrower), Mr. Sahebrao Kachrabhai Gadge (Co-Borrower) and Mr. Kunal Bipinbhai Panchal (Guarantor) to repay the amount mentioned in the notice being Rs. 14,39,466/- (Rupees Fourteen Lakhs Thirty Nine Thousand Four Hundred Sixty Six Only) as on 01.08.2019 along with interest due thereon within 60 days from the date of receipt of the said notice.

The Borrowers/guarantor having failed to repay the amount, notice is hereby given to the Borrowers/guarantor and public in general that the undersigned has taken Physical Possession of the property described herein below in exercise of powers conferred on him/her under section 13(4) of the said Act read with rule 8 of the said rules on this 10th day of February, of the year 2022.

The borrowers/secured debtors/quarantor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Central Bank of India Navsari Branch, Navsari for an amount of Rs. 14,39,466/- (Rupees Fourteen Lakhs Thirty Nine Thousand Four Hundred Sixty Six Only) and interest thereon w.e.f. 01.08.2019 plus other charges. (Amount deposited after issuing of demand notice U/Section 13(2) has

The Borrower's attention is invited to the provision of sub-section (8) of the section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.to redeem the secured assets.

roperty Bearing Navsari City Survey Tika no 11/07, City Survey No.88 "A-Tenure Land Adm 120.40.27 Sq. Meters Paiki (1)1/7th Undivided Share In The Land Adm 15.05 Sq Meters And First Floor Construction Thereupon Adm 44.60 sq. Meters Bearing Navsari Muncipal Ward No. 4, House No. 1176/3 And (2) 1/7th Undivided Share In The Land Adm 15.05 Sq.Meters And Second Floor Construction Thereupon Adm 44.60 Sq. Meters Bearing Navsari Municipal Ward No. 4M, House No. 1176/4, Situated At Mariyampura, Mochiwadi Gali, Sattapir, Navsari, Tal & Dist: Navsari Owned By Mr Krishna Sahehrao Gadge Mr Sahehrao Kachrahhai Gadge Mrs Champaben Sahebrao Gadge, Mrs. Ashaben Krishna Gadge. Bounded By- East: Open to Sky and Road, West: Passage of the Building and Flat no. 101 & 202, North: Adjoining S no.89, South: Adjoining Survey no. 87

Place: Navsari

Central Bank of India



सेन्द्रल **अं**ङ ओइ छन्डिया सेन्ट्रल बैंक ऑफ इंडिया Central Bank of India

Ghod Dod Road Branch, Harman Garder Apartment, Ghod Dod Road, Surat- 395007 M.:7567883871, Land line-0261-2259852

DEMAND NOTICE

Notice Under Section 13(2) of the Security Interest Act, 2002. A notice is hereby given that following Borrower have defaulted in the repayment of principal and interest of the loan facility obtained i.e. Term loan in the name by them from the bank and loan has been classified as a Non Performing Assets (NPA). The Notice was issued to them under section 13(2) of the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act -2002 on their last known addresss, but it has been returned with remark "Left" and

Name of Borrower/Co-Borrower and Guarantor	Description of Mortgaged Property
(1) Mr. Tejal Rajubhai Dhami(Borrower) (Plot no. 107, Dhara Residnecy Vibhag-2, Vill- velanja, Tal.Velanja, Surat-394150. (2) Mr. Raju Virjibhai Dhami (Co-Borrower) - (Plot no. 107, Dhara Residnecy Vibhag-2, Vill-velanja, Tal.Velanja, Surat-394150. (3) Mr. Ishvarbhai Karamshibhai Marvaniya (Guarantor) G-504 Yamuna Palace, Nr. Krishna Township, Mota Varachha, Surat-394101.	alongwith undivided proportionate share adm. 22.91 sq.mtrs. in common road and COP of Dhara Residency Vibhag- 2 situated on the land bearing Block no. 47/A adm. 37934 sq.mtrs., paiki 13759 sq.mtrs. of Vill-Velanja, Tal-Kamrej, Dist. Suratin the name of Mrs. Tejal Rajubhai Dhami & Mr. Raju Virjibhai Dhami. Boundries-North-Plot No. 108, South-Society Road, East-Plot no. 106, West-Society Internal Road, 1. Mortgaged Deed No. 20637, dated-15.12.2015 Registered with Sub Registrar S.R.O Kamrej, Surat 2. Sale Deed no. 20221, dated-08.12.2015.

Type of Loan	Account No.	Loan Amount	Rate of Interest	NPA of Date	Demand Notice	Total Due Amt. as on 31.01.2022
Term Loan	3950355097	12,00,000.00	7.10% (floating)	29.01.2022	31.01.2022	11,95,839.50

The steps are being taken for substitued service of notice. The above borrowers are hereby called upon to make payment of outstanding amount within 60 days from the date of publication of this notice, failling which further steps will be taken after expiry of 60 days from the date of this notice under ion (4) of section 13 of securitization and Re-construction of Financial Assets and Enforcement of

Date: 31/01/2022 Place : Surat

Authorised Officer. Central Bank of India, Surat



सेन्ट्रल बैंक ऑफ इंडिया सेन्ट्रल बैंक ऑफ इंडिया Central Bank of India

Regional Office Nanpura, Surat Varachha Branch

DEMAND NOTICE

Notice Under Section 13(2) of the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act. 2002. A notice is hereby given that following Borrower have defaulted in the repayment of principal and interest of the loan facility obtained i.e. Term loan in the name by them from the bank and loan has been classified as a Non Performing Assets (NPA). The Notice was issued to them under section 13(2) of the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act -2002 on their last known addresss, but it has been returned with remark "Left" and as such they are hereby informed by way of this public notice

	Name of Borro and C	ower/Co-Borrower Buarantor		Description of Mortgaged Property					
		18, Jeevan Dhara a, Tal- Kamrej, Dist	Jeevandhara Row H 103-A, and revenue paiki Sub Plot no. 1 a Boundries- East -S 1. Mortgaged Deed	House situated on the lan s survey no. 108+109, B adm. about 32163.00 sq.n	d bearing revenue sur lock No. 104, total ad ntrs. of Vill- Kathodara, no. 417, North- Plot No	share adm. 6.00 sq.mt vey no. 103+104+105- lm. about 33665.00 sq.m TalKamrej, Dist. Surat. o. 419, South - Society's	+106+107, Block no. htrs. sub plot no. 1 & 2		
1	Type of Loan Account No		Loan Amount	Rate of Interest	NPA of Date	Demand Notice	Total Due Amt. as on 14.12.2021		
	Cent Mortgage	4027367299	9,00,000.00	11.10%	29.10.2021	14.12.2021	8,30,073.00		

The steps are being taken for substitued service of notice. The above borrowers are hereby called upon to make payment of outstanding amount within 60 days from the date of publication of this notice, failling which further steps will be taken after expiry of 60 days from the date of this notice under sub-section (4) of section 13 of securitization and Re-construction of Financial Assets and Enforcement of Security Interest Act-2002

Place : Surat

Authorised Officer. Central Bank of India, Surat

CIN: L28910GJ1988PLC011694

Registered Office: Survey No. 55/1P6/ P1/ P1, Near Shree Stamping, Village: Sadak Pipaliya, Tal: Gondal, Dis: Rajkot 360 311, Gujarat, India Email: gangaforging@yahoo.co.in Phone: 84600 00435 Website: www.gangaforging.com

	Extract of Standalone Unaudited Financial Results for the Quarter and Nine Months ended on 31st December, 2021 (Rs. in lakhs)							
		(Quarter ended			Nine Months ended		
Sr. No.	Particulars	31-12-2021 (Un-audited)	30-09-2021 (Un-audited)	31-12-2020 (Un-audited)	31-12-2021 (Un-audited)	31-12-2020 (Un-audited)	31-03-2021 (Audited)	
1.	Total income from operations	812.09	774.19	599.81	2117.27	1619.62	2298.16	
2.	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extra Ordinary items)	62.63	89.50	-4.46	190.10	23.18	17.29	
3.	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/ or Extra Ordinary items)	62.63	89.50	-4.46	190.10	23.18	17.29	
4.	Net Profit / (Loss) for the period After Tax (after Exceptional and/ or Extra Ordinary items)	66.49	88.62	-6.80	192.58	18.96	10.73	
5.	Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)	-	-	-	-	-	-	
6.	Paid Up Equity Share Capital (Face Value Re. 1 Per Share)	1059.64	1059.64	1059.64	1059.64	1059.64	1059.64	
7.	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-	-	-	-	
8.	Earnings Per Share (of Re. 1/- each) (Not annualized) (for continuing and discontinued operations) Basic & Diluted :	0.06	0.08	-0.01	0.18	0.02	0.01	

- a) The above unaudited financial results for the quarter and period ended Dec, 31 2021 have been reviewed by the Audit Committee and were thereafter approved by the Board of Directors of the Company held on 10.02.2022. The Statutory Auditors of the Company have carried out limited review of the financial results for the quarter and period ended on 31st Dec. 2021. Their limited review report does not have any qualification/modification.
- b) The financial results have been prepared in accordance with the applicable Indian Accounting Standards as prescribed under Section 133 of the Companies Act, 2013 read with rule 3 of the Companies (Indian Accounting Standards) Rules 2015 and Amended Rules, 2016 and in terms of regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements Regulations, 2015 and SEBI Circular dated 5th July, 2016. The Company migrated to main board of NSEw.e.f. 06th July, 2021, Hence, the company adopted Indian Accounting Standards (referred to as "IND AS") and the date of transition to IND AS is 1st April, 2021. The impect of transition has been accounted for in the opening reserve and the comparative period result have been restated accordingly.
- c) The Company is engaged in the manufacturing of closed die forged products, and therefore, the Company's business fall within a single business segment. Hence, "Segment Reporting" is not applicable to the Company
- d) Pursuant to Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the aforesaid Financial Results may be accessed on the company's website at www.gangaforge.com and may also be accessed at the website of the stock exchange where shares of the company are listed at www.nseindia.com.The Corresponding figures of the previous year's /periods' have been regrouped/rearranged, whenever required.
- e) There were no investor complaints pending /received during the period under review.
- f) The figures for the quarter ended December 30, 2020 is not subject to limited review as the company was required to carry out the limited review and publish unaudited result on half yearly basis for the year ended 31st March, 2021
- g) The Corresponding figures of the previous year's /periods' have been regrouped/rearranged, whenever required. h) Reconciliation between financial results as previously reported under India GAAP and as per IND AS

Particulars	Quarter Ended	Period Ended	Year Ended
	31-12-2020 (Un-Audited)	31-12-2020 (Un-audited)	31-03-2021 (Audited)
Net profit as reported under Indian GAAP	-6.80	18.86	10.73
Add/(Less): Adjustment to total Comprehensive Income	0.00	0.00	0.00
Total Comprehensive Income as per INDAS	-6.80	18.86	10.73

For and on behalf of Ganga Forging Limited Date: 10th, February 2022 Hiralal Tilva Place: Sadak Pipaliya Chairman and Managing Director (DIN: 00022539)

11-Feb-22

(A/c No.) LNBAR00315-

Dues as on

AAVAS FINANCIERS LIMITED

(Formerly known as Au HOUSING FINANCE LIMITED) (CIN:L65922RJ2011PLCO34297) Regd. & Corp. Office: 201-202, 2nd Floor, South End Square, Mansarovar Industrial Area, Jaipur. 302020

AUCTION NOTICE

Auction Sale Notice for Sale of immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read wit proviso to Rule 8(6) of the Security Interest (Enforcement) rules, 2002 Notice is hereby given to the public in general and in particular to the Borrower (s) and Guarantor (s) that the below described immovable property mortgaged/charged to the Secured Creditor, the physical possession of which has been taken by the Authorised Officer of AAVAS FINANCIERS LIMITED (Formerly known as "Au HOUSING FINANCELIMITED") Secured Creditor, will be sold on "As is where is", "As is what is ", and 'Whatever there is" basis. The details of the cases are as under.

Amount of 13(2)Demand Notice Place of Tender Submission, Tender Open & Auction at Aavas Financiers Ltd. Name of Borrowers/ Description of Price For Property Pr Co-Borrowers/ Guarantors/Mortagors Dues As on Property 905, 9TH FLOOR KING'S PLAZA, ASTRON CHOWK, RAJKOT-360001, GUJARAT-INDIA handravadan Ambala Rs. 1165181/ 2-Feb-19 R.S. No. 29 Paiki, Plot No. 14 Paik 11:00AM K.S. NO. 29 Paiki, Piot No. B, "Shiv-Middle Part Land, Block No. B, "Shiv-Krupa-1", Nr. Railway Crossing/ Chamunda Mataji Temple, Junagadh Road, Jetpur, Tal. Rajkot, Gujrat Admeasuring- 51.85 Sq. Mtr. Patel, Mayaben Ratilal V (A/c No.) LNRAJ00314-Dues as on 11-Feb-22 140950/-To 1:PM on 15-Rs. 1067764.41/-Jan-22 150013025 Mar-2022 Shop No.17, Ground Floor, Sai Elegance Complex - Maflipur, Dholka, District -Ahmedabad-387810, Gujarat-India Dayaram Mishra, Mishra Niranjan, Mishra Minu Bungalow No. 37, Block No. 234P, Aaryavrat Bungalow, Village – Maflipur, Tehsil – Dholka, District – Ahmedabad, Gujarat. **Admeasuring 65.05 Sq Mtr.** 10-May-18 487500/ 4474378.41/-248750/ Rs. 2027224/ Jan-22 A/c No.) LNADB02217-11-Feb-22 07-May-18 Survey No. 1983 & 2077, Flat No. B/403, Akshar Arcade, Nr Swaminarayan Mandir, Kheda –bagodara Road, Tal. – Dholka, Sub-District & District – Rs. 197800/ Rs. 2546909/ 22-Jul-19 Shop No.17, Ground liren Mansukh Bhai 11:00AM **Vekariya, M**ansukhbhai Mohanbhai Vekariya, Solanki Manishben, Hardil Dues as on s. 1565884/ Jan-22 To 1:PM on 15-Mar-2022 11-Feb-22 Dues as on 22-Jul-19 Vekariya A/c No.) LNDHO00318-Flat No. A/G/3, Ground Floor, Shree Ram Appartment, Cs No: 5314, At Lunawada, Mahisagar, Gujarat. Admeasuring 552.19 Sq. Ft. Shop No:- 5 & 6, 1st Floor, Sun Rise Complex Waghodia Road, Near Mahendrakumar Motisii 15-Apr-21 Rs. L501440/ Rs. 150144/-29-11:00AM 1711115.41/ Chauhan, Ramilaben Jan-22 To 1:PM Dues as on 11-Feb-22 Vrundavan Crossing, Chanda Nagar, Vrundavan, Waghodia Vadodara-390019, (A/c No.) LNGOD02217-180050539 Dues as on 07-Apr-21 Gujarat-India Flat No. A-303, 3Rd Floor, Fb (Fakir Bhai) Avenue, Moje Dholka Tal. Dholka Tika No. 4, City Survey No. 246 & 247, Dist. Dholka, Dist. Ahemdabad, Gujarat. Admeasuring- 111.00 Sq Yards Shop No.17 ,ground Floor, Sai Elegance Complex - Maflipur, Dholka, District-Ahmedabad-387810, 10-May-18 Rs. 2295272/ 17-Jan-22 Panchal Mehul Kuma Rs. 2307500/ Rs. 230750/-11:00AM Nareshbhai, Panchal 4740351.41/-Ushaben Dues as on Guarantor : Sheth Shrenil 11-Feb-22 07-May-18 Mar-2022 Gujarat- India (A/c No.) LNADB00317-Revenue Survey No. 1202/3, Block No. 41, "Vrundavan Park Society", Village Karjan, Sub-Dist. Karjan, Dist. Vadodara, Gujarat **Admeasuring 61.72 Sq. Mtrs**. Shop No:- 5 & 6, 1st Floor, Sun Rise Complex, Waghodia Road, Near Vrundavar Rs. 172640/-Rakesh Bhansinh Kusuha 7-Nov-19 11:00AM /imalahen Kushyaha 1864342.41 1277102.41/uarantor : Vijaybhai Dues as on

| 390019, Gujarat-India
| 3900 Place : Jaipur Date : 12-2-2022 **Authorised Officer Aavas Financiers Limited**

Mar-2022

Crossing, Chanda Nagar, Vrundavan, Waghodia, Vadodara-390019, Gujarat- India

The Indian Express. For the Indian Intelligent.



larrive at a conclusion not an assumption.

Inform your opinion detailed analysis.

indianexpress.com

♦ The Indian **EXPRESS** -JOURNALISM OF COURAGE

Ahmedabad

સુરતમાં કોરોનાના કેસમાં ઘટાડો યથાવત: નવા વીજકંપનીના સ્ટાક ઉપર હુમલો કરાયો પાંડેસરા નાગસેનનગરમાં વીજિલનો આહે એક્ટોબર નવેમ્બર માસના પાંડેસરા નાગસેનનગરમાં વીજિલનો રૂપ્યા ૧૩૦૫ બિલ ભર્યું ન હોવાથી રકમ નહિ ભરતા વીજ કનેકશન ક્ષપવા માટે ગયા હતા સુરત, તા ૧૧ વધી રહી છે. અત્યાર સુધી કોરોનાના કુલ અંદર જ રહેતા આરોગ્ય વિભાગને રહ્યા ક્યા કર્યા કર્યા છે. જિલ્લામાં કહ્ય કર્યા કર્યા હતા હોજ કનેકશન કાપવા માટે ગયા હતા

કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. પરંતુ

SURAT PH-0261-2345157/2346152

WITHIN 3 DAYS

દશ્વવિલ મિલક્તોનો અભો લઇ લીધો છે.

क्षेत्राहासर्जु जाम राज्ये सरजार्जु स्थारास्त्रो

बोन भाता नंशर

XOHER-1600002205189 वी/वीशनी प. विद्वासकार सुराजार विकासी, २. दृंदल विद्वासकार विकासी, ३. डबाठेल सुराजार्स विकासी, ४. टाफ सिलेक ओडक्क, प. रोजेक्जार्स की. विकासी, ७. विका

X0HERHE00001584005 에(네마네. 고. 한다는데데 이런. 다음(네마니 다. 전쟁에서 네.

वडोबरीबा, इ. श्योत्सन्त्रहोन धोप

દોરવામાં આવે છે.

1. **લોન ખાતા ને.**

X0HERHE00002205189

रिकेक्समा विकासी.

बोब पादा वं.

3 લોન ખાતા ને.

લોન ખાતા ને.

बोब जाता वं,

⁶ बोज ખાતા जे.

X0HERHE00002036911

X0HERHE00000545742 40/48448 1. 11/20/40

परेण, उ. राहुकामा सामेतिका, ४. देवसाने

X0HERHE00001322567

सी/ब्रीअती ५. कार्येश सङ्गात

मंजुरिया, व. कोश्वकुशस कोय. मंजुरिया, उ. कारकार्धन कार्यश

बोब पादा वं.

સ્થળ : ગુજરાત,

5505.50.5P.ID

सवाविका र जीवाहोन हते.

X0HERHE00004298854

बी/बीमती. ९. मञजलाई क्षेत्र.

हासीबा, ४. पेक्स्सीबा दर्शन कीम

वी/बीभरी १. धातुबालाई स्पेशका

चापुर्दिया, १. कराचील कायुक्तवार्ध

धारीया, २. ४थशुप क्षेत्र.

पेकाडीया, उ. श्वाठील क्रीम.

X0HERHE00001686104

Chola

सुरतनी स्थिति

अञार्डना पोक्रिटिय २,०४,९७७ नवा पोतिरिव नोंधाया +450 ड्स पोतिरिव 2,08,266 वधु उपट सहित सारा थए गया - 5,00,689 વધુ ૧ સહિત કુલ મોત - 5558 सारवार हेडण पोत्रिटिव 9335

୫**୦୬୩ ଜାନ୍ତା**ଶ ବିଷ ୯(୩) ଓଡ଼େଉ

આથી મેસર્જ ચોલામંડલમ ઇવ્વેસ્ટમેન્ટ અને સુચનાન્ય કંપની લીમીટેડ ટ્યુસ્ટર્ડ ઓફીસ પહેલો માળ, ડેર હાઉસ, નં. ર, એન એસ.સી. બોઝ ટોડ, ચેક્ષઇ-૬૦૦ ૦૦૧ અને માખા ઓફિસ બી-૧૧૧ ઇન્ટરનેશનલ કોર્મસ સેન્ટર, પહેલો માળ, કડીવાળા સ્કુલ પાસે, મબુરા ગેટ, સુસ્ત-કલ્પ૦૦૨ ઘરાવતાના નીચે સહી કરનાર અધિકૃત અધિકારીને સિક્ચોરીટાઇએશન અને રીકન્જ્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ અને એનફોરેમેન્ટ ઓફ સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ અહી પછી એક્ટ કહેવાયેલ છે હેઠળ અને રિક્ચોરીટી ઇન્ટરેસ્ટ (એનફોરોમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ 3 સાથે વંચાતી ક્લમ ૧૩ (૧૨) હેઠળ પ્રાપ્ત સત્તાનો ઉપયોગ કરીને નીચે કોલમ બીમાં દર્શાવેલ દેવાદારોને કોલમ નં.(સી)માં જણાવેલ તારીખોએ માંગણ નોટીસ બરી કરી હતી.

દેવાદારો કોલમ (ടി)માં જણાવેલ રકમ ચૂકવવામાં બિષ્ફળ ગયા ફોવાથી ખાસ કરીને દેવાદારો અને જાહેર જનતાને જાજ કરવામાં આવે છે કે નીચે

સહીં કરનારે નિયમ ૮ સાથે વંશાની કલમ ૧૩ (૪), ૧૩(૧૨) હેઠળ તેમને પ્રાપ્ત સત્તાનો ઉપયોગ કરીને કોલમ (એફ)માં જણાવેલ તારીખોએ કોલમ (૪)મ

સિક્ચોર્ડ એસેટ પરત મેળવવા માટે ઉપલબ્ધ સમચના સંબંધમાં એક્ટની કલમ ૧૩ ની પેટા કલમ (૮) ની જોગવાઇઓ પ્રત્યે દેવાદારોનું ધ્યાન

માસ કરીને દેવાદાર અને જાઢેર જનતાને નીચે કોલમ(ઇ)માં જસાવેલ મિલકતો સાથે કોઇ સોદો ન કરવા સાવઇ કરવામાં આવે છે , મિલકત સાથેના કોઇપર્

રોહિ મેસર્રા ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ અને ફાચનાન્ય કંપની લીમીટેડની કોલમ(ડી)માં જણાવેલ ટકમ તેમજ વ્યાજ અને અન્ય ચાર્જને આદ્યિન રહેશે.

D

हा. ५, ८४, ५७, ५४५. ६०/-(श्र. कोट करोड सम्बादी बाज कोनामामांड दुर्गाट पामधे प्रकार करते

वीस पैसा पुरा)

droc/24/8084

\$0, QO, \$34. QO/-

(३). चार्चं बाग वीच

क्या असम्बं पालीस

काले एस हुआ मेंडा)

CE. DC/11/9001

ŲL. ₹¥, 86, 466.86/-

(क्षा क्षेत्रिस बाज

स्थाय स्थान आहरो संस्थारी छात्रे ओञ्च

शीवेर पैसा प्रस)

c#.04/34/4043

HAM

80, V4, V40. 4F/-

(३८ वीत **वा**भ फोक्स**वी**श **द**शक

बारको प्रवास कने

कत्त्रीस द्वार तैस)

CE. DE/37/2003

HAO

HAG

३८,८०,१४२.०१/-(इट स्टेक्सिस बाज

क्षेत्री क्ष्मर कर्त

जेवाबीस छने क

मुखा मुखा)

cs. 04/31/2023

HAM

sc, sq, unc. oc/-

(श. चामजीस बाज

18/1/2021

क्षांतिला

engan

મૃત્યુઆંક વધીને ૨૨૨૪ થયો: વધુ માણસા સાથ ગ્રાહક માથાકુટ કરા તમારા બલના રકમ અત્યાર નહી ભરશા તમારુ મારીને હુમલો કર્યો હોવા અંગેની ફરિયાદ વિજ કનેકશન ક્રાપવું પડશે તેમ કહેતા પાંડેસરા પોલીસ પાંડેસરા પોલીસ પાંડેસરા પોલીસ મારકમાં નોંધાઈ છે. આકી વીજબીલ નહીં મૃગેશને તમારો આ અંગે જાણવા માર્ચા દીધો હતો અને થઈ ગયા: હજુ ૧૩૩૨ સારવાર હેઠળ મુજબ ભટાર નવી

ઉપર પહોંચ્યો છે.

જિલ્લામાં ૭૩ કેસ મળીને કુલ ૧૨૦ કોરોનાની સારવાર લઇને સુરત શહેર અને કેસ નોધાયા હતા. જયારે આર્જે વધુ એક જીલ્લાના મળીને કુલ ૨,૦૦,૭૪૧ દર્દીઓ ચૌધરી ડીજીવીસીએલ કંપનીમાં પાંડેસરા મૃગેશ અને સ્ટાફના માણસો ગભરાઈને

માણસો સાથે ગ્રાહકે માથાકુટ કરી તમાચો બિલની ૨કમ અત્યારે નહી ભરશો તમાર્

આ અંગે જાણવા ભરતાં ટીમ કાર્યવાહી મારી દીધો હતો અને ાતી વિગતો ભરતાં ટીમ કાર્યવાહી હોબાળો મચાવતા મુજબ ભટાર નવી વસાહતમાં રહેતા **કરવા પહોંચી હતી** એગા થઈ થઇ ગયા કલ્યાણજી 🚃

ગયા હતા ત્યારે પાંડેસરા નાગસેન નગરમાં પોલીસ પણ સ્થળ પર આવી ગઈ હતી. રણ દી વે લઈ પાંડેસરા પોલીસે પ્રક્રશ રણદીવે સામે નામના ફરજમાં રૂકાવટનો ગુનો નોંધ્યો હતો.

કંપનીમાં લિફ્ટ નીચે કચડાતાં મીઠી ખાડીના યુવકનું મોત સુરતઃ લિંબાયત ખાતે મસોલાની ફેક્ટરી

બનાવતી કંપનીમાં કામ કરતા યુવક ઉપર ઇન્ડસ્ટ્રીયલ લિફ્ટ પડતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેનું ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ લિંબાયત વિસ્તારમાં આવેલી મીઠીખાડી નજીક ઈસ્માઈલ ચોક પાસે રહેતા 31 વર્ષિય મોહમ્મદ આસિફ મોહમદ ખલીલ અન્સારી ગોવિંદનગરમાં મસાલાની ફેક્ટરીમાં છેલ્લા પાંચ વર્ષથી કામ કરી રહ્યો હતો. મો.આસિફ શુક્રવારે સવારના સમયે ઇન્ડસ્ટ્રીયલ લિફ્ટમાં માલસામાન ચડાવી રહ્યો હતો. એ સમયે લિફ્ટમાં ટ્રોલી ફસાઈ ગઈ હતી. જે ટ્રોલીને બહાર કાઢવા માટે લિફ્ટની સ્વીચ ચાલુ બંધ કરી રહ્યો હતો.

દરમિયાન અંચાનક લિફ્ટ નીચે આવી જતા મો.આસિફ ઉપર પડી હતી. લીફ્ટ નીચે દબાય જતાં તેને માથાના ભાગે ગંભીર ઇજા થતા તેનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

૧૩માં માળેથી પટકાતા ડિંડોલીના શ્રમજીવી યુવકનું મોત

સુરતે: ડીંડોલી વિસ્તારમાં રહેતા અને મોટા વરાછા પાસેના તાપી ગ્રીન એપાર્ટમેન્ટના 13માં માળે કલર કામ કરતી વખતે નીચે પટકાયો હતો. જેને ગંભીર ઇજા થતાં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાતા સારવાર દરમિયાન મોત થયું હતું.

હોસ્પિટલના સુત્રો દ્રારા મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજનો વતની અને હાલ ડિંડોલી વિસ્તારમાં આવેલ ગાંધીનગર સોસાયટીમાં રહેતા ૧૮ વર્ષિય શનિદેવના માતા પિતા વતનમાં રહે છે. ત્યારે શનિદેવ સુરતમાં કલર કામ કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યો હતો. શ્રમિક શનિદેવ આજે શુક્રવારે સવારના સમયે મોટા વરાછા અબ્રામા રોડ ઉપર આવેલ તાપી ગ્રીન એપાર્ટમેન્ટમાં 13માં માળની બહારની સાઈડ ક્લર કામ કરી રહ્યો હતો. ક્લરકામ કરતા નીચે પટકાયો હતો. જેમાં તેને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

વીજપ્રવાહ બંધ રહેવા બાબત

પ્રાહકોને ગુજરત્તાસભર વીજપૂરવઠો આપવાના હેતુથી નીચે દર્શાવેલ સબસ્ટેશનોના નેટવર્ક મેઈન્ટેનન્સનું આયોજન કરેલ છે. આ સબસ્ટેશનોમાંથી વીજપુરવઠો મેળવતા ગ્રાહકોનો સવારના ૯ : ૦૦ થી સાંજના ૫ : ૦૦ કલાક દરમ્યાન વીજપૂરવઠો બંધ રહેશે. અનુસૂચિત સમય પહેલા વીજપુરવઠી પુનઃકાર્વરત કરવા માટે અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું.

• ૧૪/૦૨/૨૦૨૨, સોમવાર : સહયોગ ચેમ્બર (વરાછ), રાજહંસ પોઈન્ટ (ગિતાંજલી)-T2 • ૧૫/૦૨/૨૦૨૨, મંગળવાર : ડેલા મહોલ્લો (હિલ્સ નર્સરી),

૩દ્રા**લ** એવેન્યુ નં.૨.

મહાલક્ષ્મી ઈન્ડ. નં. ૨ (બમરોલી) • ૧૬/૦૨/૨૦૨૨, બુધવાર : હોનેસ્ટ ઈન્ડ. (વેડ રોડ),

ઝીલ પાર્ક નં. ૧ (કતારગામ) • ૧૭/૦૨/૨૦૨૨, ગુરૂવાર : પ્રિયા પાર્ક (વેડ રોડ)

• ૧૮/૦૨/૨૦૨૨, શુક્રવાર : K.G. જી.આઈ.ડી.સી. ઈન્ડ. નં. ૧૬ • ૧૯/૦૨/૨૦૨૨, શનિવાર : K.G. છા.આઈ.ડી.સી. ઈન્ડ. નં. ૨૭ • ૨૦/૦૨/૨૦૨૨, રવિવાર : સારથિ ઈન્ડ. નં. ૫ (પંચદેવ)

र्जिय औरकडी कडाठ प्रक्रिप्ता

વીજ સ્થાપનમાં ELCB/RCCB લગાકવાથી વીજ અકસ્માત નિવારી શકાય. **③ 8141970070** હેલા લાઈન નં. 0261-2551912 / 19128 (Toll Free),

પોર્ટલ : connect.torrentpower.com અને મોબાઈલ એપ : Torrent Power Connect

काढ़ेर जोडीस આથી જાહેર જનતાને જણાવવાનું કે, એ. યુ. સ્મોલ ફાયનાન્સ બેંક લિમીટેડ, નવસારી શાખા પાસેથી પ્રકાશચંદ્ર ગોપીલાલ ગુર્જરનાએ "શનેશ્વર નગર", વિજલપોર, તાલુકા નવસારી શહેર (જલાલપોર), જીલ્લા નવસારીના રેવન્યુ સર્વે નં. ૧૧૯/પૈકી ૧૧ (જુનો તથા નવો રેવન્યુ સર્વે નં. ૫૩૪૯ વાળી બીનખેતીની જમીન તે જમીનમાં પાડવામાં આવેલ પ્લોટો પૈકી પ્લોટ નં. ૫૫/એ જેનું ક્ષેત્રફળ ૨૬૦.૦૦ ચો.ફુટ યાને ૨૪.૧૬ ચો.મી. જમીન તથા તે જમીન ઉપર ચાલી આવેલ બાંધકામ સહીતની મિલકત નવસારી-વિજલપોર નગરપાલિકા દફતરે મ્યુ. વોર્ડ નં. ૯, ઘર નં. ૮૨૭/૦ થી નોંધાયેલ છે. તે મિલકત ઉપર લોન લેવા માંગતા હોવાનું જણાવી ટાઈટલ ક્લીયરન્સ રીપોર્ટની માંગણી કરેલ છે. સદર ટાઈટલ ક્લીયરન્સ રીપોર્ટે આપતી વેળા (૧) શ્રી ભીમભાઈ ગાંડાભાઈ પટેલ જાતે પોતે તથા (૨) શ્રીમતિ ગજરાતબેન ભીમભાઈ પટેલ ના કુલમુખત્યાર પાસેથી સદર પ્લોટવાળી મિલકત શ્રી મોહનર્સીંગ શ્રીરામસ્વરૂપર્સીંગ રાજપુતનાએ રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ નં. પ૪૭૬ તારીખ ૨૭/૦૯/૨૦૦૫ ના રોજ ખરીદ કરેલ તે અસલ ૨જીસ્ટર્ડ દસ્તાવેજ ગુમ થયેલ હોવાનું જાણવા મળેલ છે. સદર અસલ ૨જીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ નં. ૫૪૭૬

તર-તકરાર, દાવા-દુવી ચાલશે નહીં જેની સ્પષ્ટ નોંધ લેવી. તા. ૧૧-૦૨-૨૦૨૨ **મળિયા બી. દેસાઈ** (એક્લોકેટ) FF/33, સીટી સ્કવેર, લુન્સીકુઈ, નવસારી, તા. જી. નવસારી.મો.: 98790 09886

તારીખ ૨૭/૦૯/૨૦૦૫ ઉપર જો કોઈ નાણાંકીય સંસ્થા, બેંક, ઈસમે નાણાંકીય ધિરાણ

કરેલ હોય તો આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૫ માં નીચે જણાવેલ સરનામે લેખિતમાં

પુરાવા સહિત જાણ કરવી. મુદ્દત પુરી થયેથી ઉપરોક્ત મિલકત બાબત ટાઈટલ ક્લીયરન્સ

રીપોર્ટ ઈસ્યુ કરી દેવામાં આવશે અને ત્યારબાદ કોઈના પણ કોઈપણ જાતના વાંધા-વિરોધ

જાહેર નિવિદા નં.-૦૧ (સુધારો) સને ૨૦૨૨-૨૩

સુરત વન વિભાગ સુરત, જી.સુરત

તારીખ ૦૯/૦૨/૨૦૨૨ ના રોજ બહાર પાડવામાં આવેલ જાહેર નિવિદામાં ટેન્ડર ખોલવાની તારીખ ૧૯/૦૨/૨૦૨૨ ની જગ્યાએ તારીખ ૨૧/૦૨/૨૦૨૨ વંચાણે લેવી.

नायज वन संरक्षड

સરનામું: નાયબ વન સંરક્ષકની કચેરી, સુરત વન વિભાગ, ગંગેશ્વર મહાદેવમાં મંદિર

રોંડ ડી-માર્ટની સામે, સુરત.

અકાજણ, સુરત ૩૯૫૦૦૯ **इोन नं.:०२६१-२७३३८२**५

ક્રમાંકઃ માહિતી-સુરત/૧૨૧૫/૨૦૨૨ **ម-អំខផៈ**- dcfsurat2@gmall.com

Naran Lala College, Navsari **Empowering Youth** Bhagwati Sankul, Near Eru Char Rasta, Navsari-396 450

Mobile No: 70699-05151, 70699-05252 E-mail: naranlalacollege@gmail.com, Website: www.naranlalacollege.edu.in

NO.00 NO.000	Employment Notice						
Sr. No.	Name of the Post	No. of Post/s	Subject / Faculty				
01.	Principal (3rdAttempt)	01	Education				
02.	Principal (7th Attempt)	01	Law				
03.	Assistant Professor	01	Commerce				
04.	Librarian	01	200				
05.	Assistant Professor	01	Science Pedagogy / B.Ed.				

Candidates who do not possess NET/SLET/Ph.D.may also apply as Teaching Assistant in th subject of Medical Technology & Physics as per norms of V.N.S.G.U. They will be considered for interview in absence of eligible candidates for remaining vacant positions of Assistant Professor Qualifications, pay scale & service conditions are as per norms of U.G.C. Regulation 2018 & Veer Narmad South Gujarat University, Surat. Interested candidates should apply with their detailed Curriculum Vitae along with photographs, attested certificates, mark sheets, testimonials, within 10 days from the date of publication of this employment notice by Registered Post / Speed Post only in favour of The Chairma & Managing Trustee, Shri Mohanlal Harkishandas Kansara Kelavani Trust, Navsari. Date: 12-02-2022 Mahesh M. Kansara

Chairman & Managing Trustee Place: Navsari

જાહેર નિવિદા નં. એસ.કે. - ૨ સને ૨૦૨૧-૨૨ પંચાયત (મા×મ) વિભાગ, નવસારી

ङार्यपालङ र्धक्नेर पंचायत (मा×म) विलाग, नवसारी झोन नंजर (०२९३७ ર૩૧૯૦૦ ની કરોરીમાં તથા પેટા વિભાગીય કરોરી માટે નીચે જણાવેલ વિગતો માટે સ્થાનિક સપ્લાચર પાસેથી ભાવો (જીએસટી સહિત) મંગાવવામાં આવે છે. ભાવપત્રકો રૂ.૯૦૦/-૨૦/- ચલનથી જમા કરાવ્યેથી કોરા ભાવપત્રકો તા.૧૯.૨.૨૦૨૨ ના રોજ બપોરે ૨.૩૦ કલાક સુધી આપવામાં આવશે. જે તા.૨૫.૨.૨૦૨૨ સુધીમાં ૨જી. પો.એ.ડી. થી સ્વીકારવામાં આવશે ભાવપત્રકો સાથે બાનાની રકમ રૂ.૧૦૦૦૦/- નો ડી.ડી. જોડવાનો રહેશે. ભાવો મંજૂર કરવા કે ન કરવા તેના હકકો અને અંબાધિત રાખવામાં આવે છે. અન્ય શરતો કરોરીના નોટીસ બોર્ડ ઉપર જોવા મળશે. વધુ વિગત માટે કરોરીના કામકાજ સમય દરમ્યાન સંપર્ક કરવાનો

(१) डोम्युटर नेटवडींग / એन्टीवायरस सोइटवेर / पेरीइरल प्रोडडसना ભावो डोम्युटर હાર્ડવેર પાસે ભાવો મંગાવવામાં આવે છે.

(२) डोम्युटर मशीनरी अने मलुरीना ભાવો डोम्युटर सोइवर्ड पासे ભावो मंगाववाम

પંચાયત (મા×મ) વિભાગ નવસારી

Maheshwari Logistics Limited

CIN: L60232GJ2006PLC049224 trees: MLL House, Shed No. A2-3/2, Opp. UPL, 1st Phase, GIDC, Vapt-396195, Phone No. 0280-2431024, Email: Info@mlpl.blz, Webelte: www.mlpl.blz

Extract of Standalone and Consolidated Un Audited Financial Results for the Quarter ended 31st December, 2021

(Amount in Leiths Except EPS) Consolidated Particular: ii (Nine) Month Ende 31.12.2021 31.12.2020 31.12.2021 Un Audited Un Audited Un Audited Un Audited Un Audited Un Audited 1 Total Income from Operations 25,616.87 19,668.07 75,201.21 25,592.58 20,118.68 75,229.67 Earnings before Interest Depreciation and Ta (EBIDTA) 1,352.03 1,190.27 4,273.60 1,353.87 1,194.23 4,283.66 Net Profit / (Loss) for the period (before Tax, 632.01 411.95 2119.85 Exceptional and/or Extraordinary Items) 2109.82 633.85 415.89 Net Profit / (Loss) for the period before tax 2119.85 632.01 411.95 2109.82 633.85 415.89 (after Exceptional and / or Extraordinary items) Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items) 341.75 1,586,69 467.96 350,60 1,586.92 475.95 Total Comprehensive income for the period [Comprising Profit / (Loss) for the period (after text) and Other Comprehensive Income (after too)] 484.39 337.64 1,808.34 476.40 346.66 1,606.56 Equity Share Capital (Face Value of Rs. 10/- per Share) 2,959.72 2,959.72 2,959.72 2,959.72 2,959.72 2,959.72 8 Earnings per equity share (a) Basic 1.61 1.58 (b) Diluted 5.36 1.61 1.15 1.58 1.18 5.36

The above Audited Financial results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors in the pective meeting held on 11th February, 2022.

The above is an extract of the detailed format of quarterly Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the quarterly Results are available on the websites of the Stock Exchange(s) at www.nseindia.com and the Company's website at www.mlpl.btz. Figures have been regrouped wherever necessary.

On behalf of the Board of Directors of MAHESHWARI LOGISTICS LIMITED

DBN: 01880009

(भूज ओजण स्थारवार्धन प्रेसीयश स्थोन विभीटेंड) (CIN: L36910GJ2011PLC065141) રજી. ઓફિસઃ શોપ-એફ-૧, પહેલો માળ, અઠવા આર્ક શોપીંગ સેન્ટર, ચતીમખાનાની સામે, અઠવાગેટ, સુરત-૩૯૫૦૦૧, ગુજરાત. Tel.: 0261-2600343 Email: info@starlineps.com, Website: www.starlineps.com

સ્ટારલાઈનપીએસ એન્ટરપ્રાઈઝીસ લીમીટેડ

માહિની/નવસારી/૪૯૯ /૨૦૨૨

39 મી ડિસેમ્બર ૨૦૨૧ ના રોજ સમાપ્ત થયેલા ત્રીમાસીક અને નવમાસીક સમયગાળાના અલાયદા અનઓડીટેડ નાણાંકીય પરીણામોનો સાર

5	વિગત	ત્રીમાસીકની સમાપ્તી 3૧.૧૨.૨૦૨૧ અનઓડીટેડ	નવમારીક સમાપી 3૧.૧૨.૨૦૨૧ અનઓડીટેડ	39.92.2020
9	સંચાલન માંથી કુલ આવક (ચોખ્ખી)	303.00	30.8008	806.89
5	समत्रजाणा हरमित्राननो योण्डलो नक्) / (जोट) (करपेश पर्देला, अध्यादीत अने / अथया अशाधारण परतुओ पर्देल)	98.39	32.34	904.69
3	ङस्पेरा पहेलाना समयगाणा हरमियाननो घोष्मो नक्षे / जोट (अपदाहीत कर्ने / अथदा क्याधारण पस्तुमे पछी)	98.39	32.34	904.69
8	हरवेश प्रछीना समयगणा हरमियाननो योण्जो नही / (जोट) (अपवादीत अने / अथवा असाधारण वस्तुओ प्रछी)	92.95	24-34	904.69
ч	रमकारणांनी कुल व्यापक खावक (समरागाणा हरमियाननो व्यापक नको/(ओर) (करवेश पक्षी) सने सन्य व्यापक स्ववक (करवेशपक्षी)	0.00	0.00	0.00
ç	ઇક્વીટી શેર કેપીટલ	2959.40	2999.40	2959.40
b	र्गन्दीही शेर नेपीटलजी नेश येखु	¥.00	4.00	90.00
c	ભંડોળ (ગયા વર્ષની ઓડિટેડ પાકા સરવૈયા માં દર્શવ્યા મુજબ પૂનઃમુલ્યાંકિત ભંડોળ બાદ કરતા)	0.00	0.00	0.00
e	શેર દીઠ આવક (પ્રત્યેક શેર રૂા.પ/- મુજબ) (સતત અને બંધ કામગીરી માટે)			
	ყთ	0.03	0.00	0.86
	ભેગી	0.03	0.00	0.86

૧. સેબીના (લીસ્ટીંગ અને અન્ય જાહેરાતો માટે જરૂરી) નીયમ ૨૦૧૫ ની કલમ ૩૩ મુજબ ૩૧-૧૨-૨૦૨૧ ના રોજ સમાપ્ત થતા ત્રીમાસીક અને નવમાસીક નાણાંકીય પરિણામોનો ટુંક સાર ઉપર આપવામાં આવ્યે છે. ત્રીમાસીક અને નવમાસીક બિન અન્વેષિત નાણાંકિય પરિણામ સ્ટોક એર્ચેન્જની વેબસાઇટ એટલે કે websites: www.bseindia.com, www.cse-india.com અને કંપનીની વેબસાઇટ

www.starlineps.com પર સંપુર્ણ અહેવાલ ઉપલબ્ધ છે. ઉપરોક્ત નાંણાકિચ પરીણામોને ઓડિટ કમીટી દ્વારા ધ્યાને લેવામાં આવ્યા હતા અને તા.૧૧મી ફેબ્રુઆરી ૨૦૨૨ ના રોજ મળેલી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટીંગમાં મંજુરી આપવામાં આવી હતી.

ઉપરોક્ત નાણાકીય પરીણામો ઇન્ડીયન એકાઉર્ન્ટીંગ સ્ટાન્ડર્ડ (આઇએનડીએએસ) ના કંપની એક્ટ ૨૦૧૩ ની કલમ ૧૩૩ તેના અંતર્ગત સૂચીત કાયદાઓ અને સુચનાઓ મુજબ તૈયાર કરવામાં આવ્યા છે.

સ્ટારલાઈનપીએસ એન્ટરપ્રાઈઝીસ લીમીટેડ, વતી (भूण ओणभ स्टारसार्धन प्रेसीयश स्टोन सिमीटेंड)

સહી/-

શ્વેલકુમાર કોરડીયા ચેરમેન એન્ડ મેનેજીંગ ડીરેક્ટર ળઃ સુરત DIN: 03489858 44-05-5055

સુરત, તા.૧૧ વધી રહી છે. અત્યાર સુધી કોરોનાના કુલ અંદર જ રહેતા આરોગ્ય વિભાગને રોજને જિલ્લામાં કુલ 🗫ીવ કેસની સંખ્યા માટે ગયેલા ડીજીવીસીએલ કંપનીના ત્યારે કમલાબેનના પુત્ર પ્રકાશ રણદીવેને સુરત શહેર અને જિલ્લામાં કોરોના ૨,૦૪, ૨૯૭ કેસ નોર્ધાયા છે. જેની સામે મળી છે. આજે સુરત શહેરમાં ૪૭ અને ૨,૦૪,૨૯૭ ઉપર પહોંચી છે. જ્યારે જુનીયર આસીસ્ટન્ટ સહિતના સ્ટાફના પોતાની ઓળખ આપી હતી અને બાકી આજે ૧૨૦ કેસ નોધાયા હતા. જયારે ૨,૦૦,૭૪૧ દર્દીઓ સાજા થઇ ગયા છે. જીલ્લામાં વધુ ૧ દર્દીનું મોત નિપજયુ હતુ. જયારે કુલ ૨૨૨૪ મોત નિપજયા છે. કોરોનાની ત્રીજી લહેર દરમિયાન ત્રીજી લહેરમાં મૃતકોની સંખ્યામાં પણ શહેરમાં કેસની સંખ્યા સો આંકડાની

ખોરોરા

ਮੀਐ ਯੀਕਰਾਤ, ਹਾ. ਲਾਮਦੇਆ, ਲੂ. ਸੂਦਰਗਾ ਦੇਰੇਕ੍ਰ ਦਹੋਂ ਕੰ

੪੫૩, ੦લોક નં. ૪૨૦ ખાતે સ્થિત માફતિ નગર સોસાચઢીમાં

કુલ પદ્દ રા મી.માપના તે સમગ્ર બ્લોક ને. ૪૨૦. ચતુઃસીમાઃ **પૂર્વઃ** ભ્લોક નં. ૪૭૬ ની જમીન, **પશ્ચિમઃ** ભ્લોક

र्न. ४२० नी બાકीनी क्योन, **8त्तरः** सर्वे र्न. ४५२ नी બीन-

देवञ्चलार्व लीजालार्व बडोहरीचा खने अनसुजलार

ओणावार्त वडोदरीयानी मासिकीना गाम सरवासा, ઉप-જ

સિટી, જી. સુરત ખાતે ૨૪૯૯૭ થો .મી. માપના ૦લોક નં . ૧૫૨,

આર.એસ.ને. ૧૮૧ અને ૧૫૮ ખાતે સ્થિત આર્શિવાદ

दोसायरीमां क्षेमन पञ्चा अने आंतरिक रोडनी पभीनना

अविभाजत दिस्सानी साथे तेनी परना जांधकाम सहित

९०४.०२ थो.वार એટલે हे ८०.०२ थो.भी.भापना प्लोट नं.

୧୦୦ (ବୁନା ନୀ. ୧୦૨) ମା ଯ୍ୟାଥ ଧୀର ଅମ ଧାର୍ଯଣ ୫ଥିପ

भिवस्तनी यतुःसीमाः पूर्वः प्वोट नं. १०२/यो , पश्चिमः ०सोस् नं.१५१, क्रिक्टः प्वोट नं.१०३, ६क्षिणः प्लोट नं.८३

સગનભાઈ અન્યુભાઈ પૈકામિયા અને જસ્યુભ અન્યુભાઈ પૈકાકીયાની માલિકીના ગામ છાપરાભાઠા, ઉપન્જી. સિટી, જી. સુરતના આર.એસ.ને. ૫૦૪/૩ (પૂર્વ દિશાના ભાગ) ધરાવતી

જમીન ખાતે સ્થિત બળવંતનગર છે. એ હ્યા સોસાયટી ના આશરે ૫૪.૩૫ ચો.મી.માપના પ્લોટ નં. દૃદ્દ ના તે તમામ પીસ અને પાર્સલ.

क्षित भिवक्तनी **कतुःशीमाः पूर्वः** प्रोट नं. इड नी भिवक्त, प्र**वि**मः प्रोट नं. इप नी भिवक्त, **डेंच्यः** शोशायटीनो रोड,

कातुबकार्य क्ष्मेश्रकार्य अनुडीशाजी माखिडीला मोले

છાપરાભાદા, સુરત શહેરના આરએસ નં. ૪૧ ના ક્રષ્ટદ્રક

यो.भी.भापना ज्वोड नं. ११५ अने आस्मेर नं. ४०/२, ४०/३

ना १,९२० थो.भी.भापना क्लोक नं. १९६ अने टेवेन्यु सर्वे नं.

34/૧ ના પરદ્દવ ચો.મી.માપના બ્લોક નં. ૧૨૦ એમ કુલ ૧૪૭૬૮

ચો મી . ખાતે સ્થિત પ્રમુખ પાર્ક માં રોડ અને સી .ઓ પ્રી ,ની જમીનમાં દૂપ.૩૮ ચો.મી . અતિભાજીત ક્ષિસ્થા અને ૨૪.૮૦ ચો.મી . માર્જિન સક્ષિત ૨૪ % ૩૫ ફીટ એટલે કે ૭૮.૦૬ ચો.મી માપના સમગ્ર પ્લોટ ન .

૧૩૪, ૧૩૫. **ચતુ સીમ્ક પૂર્વ** રોડ, **પવિનક** પ્લીટ નં. ૧૩૬ અને ૧૩૦, ઉત્તર પ્લોટ નં. ૧૩૩, **દક્ષિકઃ** રોડ.

કુલપાડા, તા. સિટી, જી. સુરતના આર.એસ.નં. ૯૪/૨,

કો.ઓ.ઢા.સો.લિ. માં. સિટી સર્વે વોર્ડઃ કુલપાડા, નોંધ નં.

ssce, બંગલો નં. ૬૪/સી (૬૫.૧૦ ચો.મી.) ધરાવતા તે તમામ

બિલ્ટ અપ भिभावसीस. ६थित भिवक्तनी **चतुःसीभाः पूर्वः**

સોસાયટીનો રોડ, **પશ્ચિમ** મિલકત નં. દૂપ/સી, **ઉત્તર** મિલકત

ગામ કાપોદા, ઉપ-જીલ્લા સુરતના કુલ ૩૮૮૪૮ ચો.મી.માપના સર્વે નં. ૧૫ પૈકી, ૧૬/૧ પૈકી, ૧૭ પૈકી ઘરાવતી જમીન ખાતે

खित समलपार्ड हो ओ हा हो वि. विભाग-२ ना १२१.२८

ચો.ਮੀ.ਮਾਪਕ। ਪ੍લોટ ਕਂ. ૨૫/એ ਕਾ ਹਮਾਮ ਪੀસ અને ਪਾर्सલ.

કਵਿਰ ਮਿਰਤਰਕੀ **ਕਰੂਈਆ ਪੂਰ** ਦੀ ਗ**ਈ** ਕੇ ਤੇ, **ਪਵਿਸ਼**

993/9, 993/2 **धरावती જમીન પર સ્થિત** વલ

શા. ૧,૦૧,૦૭,૫૯૧.૪૫/-(શા. એક ૦૩૫૪ એક લાગ **૧૫૧ લવક** વ. ૧૭ લરાક વર્ષક વ. ૧૭ લરાક લાગ લવક વ. ૧૭ લરાક લાગ લાગ કરાય છે. માં તેની

बान महा है कर का जी कर किया जी का ज

र्ज. ६३/सी, **धवित्यः** सोसायटीनो रोड.

हिंदिक प्लोट नं. ७१ नी भिवडत

ખેતીલાગ્રહ જમીન , દક્ષિણ: ૨૦ કીટ પ્ઢોળો એક

AVAILABLE FOR SALE **EICHER PRO 6037** MODEL 2018

GJ-19-X-5132 "AS IS WHERE IS" CONDITION CONTACT SUNDARAM FINANCE LTD

ચોલામંકલમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સ કંપની લિમેટિક સ્કુસ્થઈ નોર્મિસ પહેલો માળ, કેટ હાઉસ, ન. ૨, એન.એસ.સી. બોઝ રોડ, રોજાઇ- ફુવવ ૦૦૧ સામા સ્થેફિસ બી-૧૧૧ ઇન્ટરનેશનલ કોર્મસ સેન્ટર, પહેલો માળ, કડીલાળા સ્કુલ પાસે, મજુરા ગેટ, સુરત-૩૯૫૦૦૨

અત્યાર સુધીમાં સુરત શહેર અને ૧૩૩૨ ઉપર પહોંચી છે.

વ્યક્તિ મોતને ભેટી હતી. જેમાં બારડોલી સારા થઇ જતા તેમને રજા આપવામાં સબ ડિવિઝનલ ઓફિસમાં જુનીયર ત્યાંથી નિકળી ગયા હતા. તાલુકાના તેના ગામે ૬૬ વર્ષના પુરુષનું આવી હતી. ડિસ્ચાર્જ કરાયેલા દર્દીઓ આસીસ્ટટ તરીકે નોકરી કરે છે. મૃગેશ ત્યારબાદ મૃગેશ તેના ઉપરી ક્રોરોના મહામારીમાં મૃત્યુ નિપજયુ હોર્વાનું પૈકી આજે સુરત શહેર -જીલ્લાના <u>ક</u>લ ચૌધરી ગઈકાલે સવારે સ્ટાકના માણસો અધિકારીને કોન કરી બનાવની જાણ જણાવ્યુ છે. આમ, કુલ મૃત્યુઆંક ૨૨૨૪ ૩૫૮ દર્દીઓનો સમાવેશ થાય છે. જયારે સાથે વીજબિલની ૨કમ નહી ભરનાર ૪૨ કરતા તેઓ સ્થળ પર પંહોચી ગયા હતા

એક્ટીવ દર્દીઓની સંખ્યા પણ ઘટીને જેટલા ગ્રાહકોના વિજ જોડાણ કાપવા માટે અને ત્યાંથી પોલીસ કંટ્રોલમાં ફોન કરતા

सर्वाहर कामाना , तथिन रहा, वनसहाह प्राह्मक का अन्तरं किल्पुर्व के स्थान के जिन्ही क्रीजीको, इस्स, २००२की क्रम १.६(१२) वा लिसम 3 सवै वांचा असेवी सत्तावी हुने तारीण रंप/१९/२०२१ वा रोण करम १.६(१२) वा लिसम 3 सवै वांचा असेवी सत्तावी हुने तारीण रंप/१९/२०२१ वा रोण करमध्य/भानिकार/भोनेंपर की प्रवक्त भोरारा इस्क (क्रम्पार) अने वींमत स्वीवा भोरारा इस्क (क्रम्पार) अने वींमत स्वीवा भोरारा इस्क (क्रम्पार) अने वींमत स्वीवा भोरारा इस्क (क्रम्पार) अने वींमत वोंचीय प्रवं । स्वावा अनेक्ष्मत क्रम्पार कर्म १९०० वा तार अनेक्ष्मत क्रम अप आठवे एक नोरीय प्रवक्ता वर्गाय अने क्रमेरिया प्रवक्ता अप वार्त क्रमेरिया प्रवक्ता कर्म कर्म क्रमेरिया अप वार्त क्रमेरिया अप वार्त क्रमेरिया वार्त कर्म इस्क विकास क्रमेरिया वार्त कर्म इस्क विकास क्रमेरिया वार्त कर्म इस्क वार्त कर्म कर्म वार्त क्रम वार्त क्रम वार्त क्रम वार्त कर्म वार्त कर्म वार्त कर्म

मोर्जेप वर/क्ष्मीन स्थित भारेट नं. १४३, आप १४३ थो.मीटर्स, चे छोन छो क्सीनन। भागनी रेपन्यु सर्वे तं. १००७ (क्षेण्युप्रशाधिक सर्वे तं.-१००७ पेती १४३) विधत गाम सनवार्व ता. सने सु: वससाठ: सा विसकत की पवन मेरस्टस साढ़ वा नामनी: चेनी बातुःदिशा : पूर्वे : प्रांडि तं.१४९, पविले : सांतरिक स्त्रतो, व्रत्तरे : बोडावेश प्रमीन, हिंगु : प्रांड तं.१४४. અધિકૃત અધિકારી, ઈક ઓફ લશેકા तारीभ : २०/०२/२०२२ २६७ : प्रस्थाऽ

એડેલ વેઇઝહાઉસિંગ ફાઇના ન્સ લિમીટેડ રજિસ્ટર્ડ એફિસ: એડેલ વેઇઝ હાઉસ,સીએસ્ટી રોડના નાકે, કાલિના, મુંબઇ - ૪૦૦૦૮૮ રિજ્યોનલ એફિસનું સરના મુ: ૩૦૧-૩૦૪,ગીજા માદ્યો, થર્ડ આ ય વિઝન, શિવાલિક લાઝાની સામે ,આઈઆઈએમ,પાંજરાપોળ નજીક,અમદાવાદ -૩૮૦૦૦૯

સરફાએસી એક્ટ ૨૦૦૨ ખંડ -૧૩(૨)મુજબ ડીમાન્ડ નોટીસ

આથી નીચે જણાવેલાં દેવાદાસ્ રો)એ એડલવેઇઝ હાઉસિંગ ફાયનાન્સ લિમિટેડ પાસેથી લોનની સુવિધા મેળવી હતી. परंतु लोननी मूण रहम अने तेना परना व्याप सहितनी रहम यूडववामां निष्कृण पतां तेमनां जाताओ नोन પરફોર્મિંગ એસેટ્સ(એનપીએ) જાહેર કરવામાં આવ્યાં છે. તેથી તેમને સિક્યુરિટાઇઝેશન એન્ડ રિકન્સટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એસ્સેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરિટી ઇન્ટરેસ્ટ એક્ટ ૨૦૦૨ (સરફાએસી એક્ટ)ના ખંડ ૧૩(૨) મુજબ તેમના જાણીતા સરનામાઓ પર ડીમાન્ડ નોટીસો મોકલવામાં આવી હતી. ઉપરોક્ત નોટીસો ઉપરાંત તેમને આ જાહેર નોટીસ દ્વારા પણ જાણ કરવામાં આવે છે. દવાદારો, ગિરો મિલકત, બાર્કી લેણા, વગેરે સાથે ખંડ ૧૩(૨) મુજબ ઉમાન્ડ નોટીસ મોક્લવામાં આવી હતી.

ાવો કરવામાં આવેલી રકમ નીચે જણાવવામાં આવી છે. 3. हेबाहारो, सह-हेबाहार, क्षामीनहारनां नाम, सरनामुं, बोन એકाઉन्ट नं. अने बोननी बेधी नीडणती रडमः

Yरंअदाद सांवताराम तेतरवाद (हेवाहार) संपु डुडी (सह-हेवाहार) अने रापुराम सांवताराम तेतरवाद (सह-हेवाहार) **એ બધા રહેવાસી**: બી-૧૦૩, અર્પણ કોમ્પલેક્સ, મગોબ, ચોર્ચાસી, બોમ્બે માર્કેટ-૩૯૫૦૧૦ **અને તેઓ અહીં પણ**ઃ બી/૧૦૩ , પહેલા માળે , બી બિલ્ડીંગ અર્પણ કોમ્પલેક્સ , વરાછા કો-ઓપરેટીવ બેંક લિમિટેડની સામે પુણા કેનાલ રોડ, મગોળ, સુરત-૩૯૫૦૧૦ લેન નં.: LSUROTU0000018588 અને LSUROHL0000018561 લોન એગ્રીમેંન્ટની તારીખઃ રહ સાટે.૨૦૧૬ અન

दोननी २५म : ३.८४५०००/- (३पिया आठ वाप्त पिस्तावी स हक्तर पुरा) अने **३८७०००/- (**३पिया श्रष्टा वाप्त सत्तार्थ हक्तर ત્રાકો **નોકળતી રકમઃ રૂ.૮,૪૫,૯૮૮.૯ડ!-** (રૂપિચા આઠ લાખ પિસ્તાલીસ હવા**ર** વવસો અઠ્યોતી અને નવ્યાછું પૈસા પુરા **અને ૩૬,૯૪૨૯.૭૮** (રૂપિચા ત્રણ લાખ ઓગણસ્તિટ હવાર ચારસો ઓગણત્રીસ અને અઠ્યોતેર પૈસા પુરા)

ક્ષેત્રફળ ૪૩૩ ચો.ફૂ. અથવા ૪૦.૪ ચો.મી. બિલ્ટઅપ એટીચાની સાથે ૨૨.૩૫ ચો.મી. અર્પણ કોમ્પલેક્સ બી ટાઇપ ન અવિભાજીત જમીનનો ભાગ. ટેવન્થુ સર્વે નં. ૩૯/એ પૈકી, બ્લોક નં. ૬૧/૧ પૈકી ક્ષેત્રફળ ૪૩૮૦ ચો.મી. મોજે ગામ મગોબ સીટી સુરત**. વેચાઇખત મુજબ ચતુર્સમા તોચે મુજબ છે. ઉત્તર**ઃ પેસેજ પછી સોસાચટીનો રોડ, **દક્ષિ**ણેઃ પેસેજ અને દાદર પૂર્વેઃ ફ્લેટ નં. ૧૦૪, **પર્ધિ**મેઃ ફલેટ નં. ૧૦૨.

». ૪. દેવાદાર, સહ-દેવાદાર, જામીનદારનાં નામ, સરનામું, લોન એકાઉન્ટ નં. અને લોનની રકમ: રૂક્સાના ખાતુન મોહંમ્મદ મેરાજ ખાન (દેવાદાર) અને મોહંમ્મદ મીરાજ અલિમુદ્દીન ખાન (સહ-દેવાદાર) એ બધા રહેવાસીઃ ૧૦૩, ૧૦૨ શ્રેયા કોમ્પલેક્સ જુના સી ટાઇપ, વાપી, પારડી, વલસાડ, વાપી ૩૯૬૧૯૧. **ઝને તેઓ અહીં પણ**ઃ ફલેટ નં. ૧૦૩, પહેલા માળે, મુસ્કાન એપાર્ટમેન્ટ , છરવાડા , તા .વાપી , જી .વલસાડ , વાપી કલ્ફ૧૯૧ લોન એગ્રીમેન્ટની તારીખઃ ૨૬ સપ્ટે.-૨૦૧૮ ਰੇਗ ਗਂ.: LVAPSTH0000058842. **લોનની સ્કમ : રૂ.૧૩૮૫૦૦૦/-** (રૂપિયા તેર લાખ પંચ્યાસી હબાર પુરા)

दिभान्द नोश्रीभनी ताजीभः वृहमी अन्य २०२२ **નોનની લેણી નીકળતી રકમઃ રૂ.૧૦,૭૨,૯૭૨.૩૯/-**(રૂપિયા દસ લાખ બોત્તેર હુજાર નવસો બોત્તેર અને ઓગણ યાલીસ પેસા પુરા)

शिश्चे राजचामां आवेबी मिसङतनुं वर्धनः तमाम जंड के अजंडीत लागनी जनेवी मिसकत इसेट नं. १०३ ક્ષેત્રફળ આશરે ૮૧૫.૦૦ ચો.ફૂ. અથવા ૮૫.૦૩ ચો.મી. સુપર બિલ્ટ અપ એરીયા, બીન ખેતી જમીન પર બાંધવામાં આવેલ ''મુસ્કાન એપાર્ટમેન્ટ'' તરીકે જાણીતા બિલ્ડીંગના પહેલા માળે, સર્વે નં.૨૬/પૈકી, પ્લોટ નં. ૩૧ ક્ષેત્રફળ ૨७૦.૦૦ ચો.મી. કોમ્પ્યુટરાછાડ સર્વે નં. ૨૬/૧ પૈકી ૨૩, છરવાડા, તા.વાપી,જી.વલસાડ વેચાણખત મુજબ ચતુર્સીમા નીચે મુજબ છે. ઉત્તરેઃ ખુલ્લી જગ્યા, દક્ષિણેઃ ફલેટ નં. ૧૦૨, પૂર્વેઃ ફલેટ નં. ૧૦૪ , પશ્ચિમેઃ ખુલ્લી જગ્યા.

ઉપર જણાવેલા દાવાદાર/રોને જાણ કરવામાં આવે છે કે તમારા પાસેથી લેણી નીકળતી ઉપર જણાવેલી રકમ આ નોટિસની તારીખ થી દિવસ ૬૦માં ચૂકવી દેવી. તેમ કરવામાં નિષ્ફળ ગયેલ નીચે સહી કરનારને સરફાયેસી એક્ટના અંતર્ગત ઉપર જણાવેલી ગીરવેં મિલકત માટે પગલાં લેવાની ફરજ પડશે. મહેરબાની કરીને નોંધ લેશો ક એક્ટના ખંડ ૧૩(૧૩)ની જોગવાઇ મુજબ તમને ઉપર જણાવેલી ગીરવે મિલકત નું વેચાણ, લીઝ, અથવા મન્થ કોઇપણ માર્ગે હસ્તાંતરણ કરવાથી દુર રહેવા જણાવવામાં આવે છે. સહી/- અધિકૃત અધિકારી

વર્તી એક્લવેઇઝ હાઉસિંગ ફાયનાન્સ લિમિટેક

25/11/2027 (१६५ सहरू कारकार भ्वोट नं. १८, **र्डचरः** भ्वोट नं. २६, **दक्षिकः** भ्लोट नं. २४ CH. OC/11/4041 अधेशकार्व मंजुरिया, प. HAGE **भावनायोन योग.** मंगुकिया स्थी/- स्वविकृत स्वरिकारी, बोबार्गडबाम र्वन्येस्टरनेन्ट रोज्ड दुर्शन्त्रका रूपनी विगोदेड तारीम : ०६.०६.६०६६ जेंध : विवादनी स्थितीमां था जोटीस अंग्रेक्ष कानुवाद मानव अञ्चारो. eno: Maci C-NTRUM

કોર્પોરેટ એન્ડ રજિસ્ટર્ડ ઓફિસ : યુનિટ નં.૮૦૧,સેન્ટ્રમ હાઉસ, સીએસટી રોડ, વિદ્યાનગરી માર્ગ, ડિમાન્ડ નોટીસ કાલિના, સાન્તાકુઝ (ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૯૮, CIN No. U65922MH2016PL273826

(સરકાઈસી એક્ટ)ની સેક્શન ૧૩(૨)ની સાથે સિક્ચરીટી (એન્કોર્સમેન્ટ) રૂલ, ૨૦૦૨ના રૂલ ૩(૧) અંતર્ગત આથી નીચે સહી કરનાર સેન્ટ્રમ હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડના અધિકૃત અધિકારીએ નીચે જણાવેલા દેવાદાર (રો)(કથિત દેવાદાર) ને ડિમાન્ડ नोटीस सिङ्युरीटी)ŷशन એવ્ડ रीङव्य्टूङशन ओङ् झार्चनाव्शियल એસેટસ એવ્ડ એવ્ફોર્સમેવ્ટ ઓફ સિङ्युरीटी र्घव्टरेस्ट એક્ટ २००२ (सरझार्यसी એક્ટ)ની સેક્શન ૧૩(૨)ની સાથે વંચાણે લેતા સિક્યુરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ, ૨૦૦૨ના રૂલ 3 અંતર્ગત આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ

सिक्युरीटीफ्रेशन એन्ड रीक्टरटुक्शन ऒङ् झाईनान्धियलेशेहरा એन्ड એन्डोर्समेन्ट ऒङ् सिक्युरीटी ईन्टरेस्ट એक्ट र००र

કરતા કથીત એક્ટના ખંડ ૧૩(૨) મુજબ ડીમાન્ડ નોટીસ મોક્લવામાં આવી હતી. જેની વિગતો નીચે મુજબ છે. ઉપરોક્ત અનુસંધાને દેવાદારોને ફરીથી નોટીસ મોકલી સેન્ટ્રમ હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડને બાકી લેંશી નીકળતી રકમ વતા ચડત વ્યાજ અને ખર્ચ સહિતની લેહી રકમ આ નોટીસ પ્રકાશિત થયાના દૃ૦ દિવસમાં ચુકવી દેવા જચાવવામાં આવે છે. કથિત નોટીસમાં નીચે જચાવેલ તારીખ થી ચુકવાચું થાય કે રકમ જમા થાય જે લોન એગ્રીમેન્ટમાં અથવા અન્ય દસ્તાર્વેજી/લખાગ જે કોઈ હોય તો દેવાદારે લોનની સલામતી માટે નીચે જગાવવામાં આવેલી મિલકતો સેન્ટ્રમ હાઉસિંગ કાઈનાન્સ પાસે ગીરો મકવામાં આવી હતી તે આ મુજબ છે.

અ. નં.	हैवाहार(रो) / सह हैवाहार(रो) सने जमीनहार(रो)ना नाम / जाता नं. / शाजा	કુલ બાકી સ્ક્રમ (રૂ.)	એનપીએ તારીખ ખંડ ૧૩(૨) નોટીસની તારીખ એ ફસીએલ તારીખ	ગીરો મુકેલ સ્થાવર મિલકતનું વર્શન
1	રવિતાદેવી ઈંદલકુમાર ચૌધરી/	Rs. 934072/-	10-12-2021	તમામ અધિકારો ખંડ કે અખંડીત ભાગની બનેલી સ્થાવર મિલક્ટ
	ઈંદલકુમાર લલનરામ ચૌધરી/	(રૂપિયા નવ લાખ ચોગીસ	30-01-2022	પ્લોટ નં.૮૪, આરાધના રેસીડેન્સી, સત્યમ રેસીડેન્સીની સામે, ફલધર્
	STVST18001367 / સુરત	હજાર બોત્તેર પુરા)	14-01-2022	રોડ, ફલધર્, કામરેજ, સુરત, સુરત-૩૯૪૩૧૦, કામરેજ, ગુજરાત.
2	વિજય અંબેલાલ માક્ષાવંશી/	Rs. 836606/-	10-12-2021	તમામ અધિકારો ખંડ કે અખંડીત ભાગની બનેલી સ્થાવર મિલકત ક્લેટ
	કિંજલબેન વિજયભાઇ માક્ષાવંશી	(રૂપિયા આઢ લાખ છગીસ	30-01-2022	નં. એ/૩૦૨ મેહલ કો.ઓ.હા.સો.લી., ગુરૂદેવ એપાર્ટમેન્ટ, પોસ્ટ ઓફીસની
	STVVP18002555 / સુરત	હજાર છસો છ પુરા)	14-01-2022	પાસે, રેંટલાવ, ઉદવાડા, તા.પારડી, વલસાડ ૩૯૬૧૨૫, પારડી, ગુજરાત
3	બાબુભાઇ પરેષોત્તમભાઇ પટેલ/ કેલાશબેન બાબુભાઇ પટેલ/ BDQBH18002096/વડોદરા	Rs. 1046715/- (રૂપિયા દસ લાખ છેતાલીસ હજાર સાતસો પંદર પુરા)	10-12-2021 31-01-2022 14-01-2022	તમામ અધિકારો ખંડ કે અખંડીત ભાગની બનેલી સ્થાવર મિલકત જિલ્લો ભરૂચ પેટા જિલ્લો ભરૂચ મોજે ઝાડેશ્વર રે.સર્વે નં. ૪૧/એ, ૪૧/બી, ૪૫/૧+૨, ૪૨ અને ૪૪ પૈકી સાંઇ વાડી બંગલો, પ્લોટ નં. એ-૧-૫૫ ક્ષેત્રફળ ૬૯ છદ ચો.મી. ૪૦૦ ચો.મી. અવિભાજીત જમીનનો ભાગ, ચર્તુસીમાઃ પૂર્વેઃ પ્લોટ નં. એ-૧/૪૬, પશ્ચિમેઃ આંતરીક રોડ, ઉત્તરેઃ પ્લોટ નં. એ-૧/૫૪, દક્ષિણે ઃ પ્લોટ નં. એ-૧/૫૬.

જો કથિત દેવાદારો સેન્ટ્ર્સ હાઉસિંગ ફાઈનાન્સ વિમીટેડને ઉપર જણાવેલ ૨કમ ચુકવવામાં નિષ્ફળ જશે તો સેન્ટ્ર્સ હાઉસિંગ ફાઈનાન્સ વિમીટેડ ગીરો મુકેલ भिवङत साभे सिङ्युरीटी)प्रेशन એन्ड रीङन्स्टूङशन ओङ् ફाઈनान्शियव એसेटस એन्ड એन्ड)संभेन्ट ઓફ सिङ्युरीटी ઈन्टरेस्ट એક्ट २००२ (सर्ट्साईसी એક્ટ)ના સેક્શન વંડની સબ સેક્શન (૪) અંતર્ગત દેવાદારોના હિસાબે અને જોખમે પગલા વેશે એનાથી ઉભા થનારા સંજોગો માટે દેવાદારો જવાબદાર હશે. કથિત દેવાદારો ઉપર જણાવેલ મિલકતનું સેન્દ્રમ હાઉસિંગ ફાઇનાન્સ લિમીટેડની અગાઉથી લેખીત મંજૂરી વિના વેચાણ,ભાડાપકે કે અન્ય કોઇ પણ રીતે હસ્તાંતરણ કરી શકશે નહીં. બે કોઈ કથિત નિયમ કે રૂત્સની બેગવાઈનો ભંગ કરશે તો તે એક્ટૅની બેગવાઈ મુજબની કેદ અને અથવા દંડને પાત્ર ઠરશે.

અધિકૃત અધિકારી, વિત સેન્ટ્રમ હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ

Printed by Manojbhai Laljibhai Mistry at GUARDIANPRESSB-17/2, Hojiwala Industrial Estate, Sachin-Palsana Road, Near Sachin, Suraton behalf of owners Manojbhai Laljibhai Mistry & Published by Manojbhai Laljibhai Mistry at Guardian House, Surman Desai ni Wadi, Udhna Darwaja, Ring Road, Si 02 on behalf of Owners Manojbhai Laljibhai Mistry Editor: Manojbhai Laljibhai Mistr